https://archive.org/details/bk068/page/n0/mode/1up

1921-10-21 -Sobute Azadari (68)

All Items on https://archive.org/details/realpatidar

Full Library on https://realpatidar.com/library

Patel Shivjee Kanjee

સોબુતે અઝાદારી.

વ

કલામે આગાખાની.

લખનાર—મોહમેડન.

છપાવી પ્રગટ કરનાર

એદલજી ધનજી કાપા.

અમરેલી—કાઠીઆવાડ.

વકફ કરાવનાર

શેઠ વલીભાઇ શરીફ.

અનલ્હાવા (માડાગારકાર)

આવૃત્તિ પહેલી — પ્રત ૧૦૦૦ — ઇ. સ. ૧૯૨૧

ધી અરૂણોદય પ્રીન્ટીગ પ્રેસ—અમરેલીમાં મેનેજર ધારશી ડાહ્યાભાઇએ છાપ્યો. તા. ૨૧-૧૦-૨૧

વકફ.

realpatidar.com

https://archive.org/details/bk068/page/n1/mode/1up

Real Patidar Library

https://www.realpatidar.com/library

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

No specific pages. See whole book.
References by: RealPatidar.com

https://archive.org/details/bk068/page/n2/mode/1up

1921-10-21 -Sobute Azadari (68)

Patel Shivjee Kanjee
Karachi

realpatidar.com

સોબુતે અઝાદારી.

વ

કલામે આગાખાની.

લખનાર—મોહમેડન.

છપાવી પ્રગટ કરનાર

એદલજી ધનજી કાબા.

અમરેલી—કાઠીઆવાડ.

વકફ કરાવનાર

શેઠ વલીભાઇ શરીફ.

અનલ્હાવા (માડાગારકાર)

આવૃત્તિ પહેલી   પ્રત ૧૦૦૦   ઇ. સ. ૧૯૨૧

ધી અરૂણોદય પ્રીન્ટીગ પ્રેસ—અમરેલીમાં મેનેજર
ધારશી ડાહ્યાભાઇએ છાપ્યો. તા. ૨૧-૧૦-૨૧

વકફ.

realpatidar.com

https://archive.org/details/bk068/page/n3/mode/1up

realpatidar.com

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk068/page/n4/mode/1up

1921-10-21 -Sobute Azadari (68)

realpatidar.com

પ્રસ્તાવના.

મી૦ મોહમેદમનો આ લેખ પેમ્ફલેટ દ્વારા પબ્લીકમાં મુકતાં અમોને ઘણો આનંદ થાય છે. તેમણે પોતાનો લેખ સચોટ વધા અસરકારક બનાવવા માટે, પ્રસંશનિય પ્રયાસ કર્યો છે તે માટે તેઓ ધન્યવાદને લાયક છે. મુંબઇની ઇસ્માઇલીઆ આહિત્ય ઉતેજક મંડળ તરફથી મી૦ નુરમાહમદ બાબુલ ઉનાવાળાએ " મુશ્કેલાત ભાગ ૧ લો " નામક પેમ્ફલેટ છપાવી હજરત ઇમામ હુસેન અ૦ ની અઝાદારી પ્રત્યે નિર્દય પ્રહારો કરેલા છે. ઉક્ત મંડળે પોતાની મલીન ધુનના આવેશમાં તે પેમ્ફલેટની દસ હજાર કાપીઓ ખોજાઓમાં વાંટી છે. તેની વધુમાં વધુ કાપીઓ ઇસનાઅશરી ખોજાઓમા ફેલાવી છે તેનો બહોળો ફેલાવો ઇસનાઅશરી ખોજાઓમાં થાય તે માટે ઇસ્માઇલી માસીકોએ :તે માટેની જાહેરાતો પોતાના માસીકોમાં લાગ લાગટ છાપી :છે. ઇસ્માઇલી સત્પંથ પ્રકાશ તો પોતાના ગ્રાહકોને તે ભેટ ;માસીક સાથે આપી છે.

છેલ્લા બે ત્રણ દાયકામાં પોતાને ઇમામી ઇસ્માઇલી અલકાબથી સંબોધનારા વર્ગમાં હજરત ઇમામ હુસેન અ૦ ની અઝાદારી કરવી એ સામાન્ય બાબત હતી. આ મઝલુમે કરબલાની અઝાદારીમાં જે સત્યનો સ્વીકાર અને અસત્ય પ્રત્યે તિરસ્કાર

realpatidar.com

realpatidar.com

ફરનારા હીદાયતી ગોહરો ઠામ ઠામ ભરેલાં છે તે ખોજા કોમને પોતાનો ઓજમતી અસર દેખાડવા લાગ્યાં અને તેણે ખોજાઓમાં ઘુસી ગએલી ધાર્મિક ગુમરાહીને હડસેલવા માંડી. પરીણામે હજ્જારો ફરુઓ ગુમરાહી તજી શુદ્ધ ઇસલામને તાબે થયા, પરંતુ આમ થવાથી કોમને જળોની જેમ વળગેલો સ્વાર્થી વર્ગ ચેતી ગયો કે, આ અઝાદારીએ ઇમામજ ખોજાઓને શુદ્ધ ઇસલામી બનાવી આપી આપણા પંજાથી છટકાવી નાખે છે. માટે હાલ જેટલો વર્ગ કબજામાં રહયો છે તેને જો ટકાવી રાખવો હોય તો, આ અઝાદારીએ ઇમામને સદંતર બંધ કરવી જોઇએ. આવા નિર્ણય પર આવી દરેક ગામની જમાતમાં દર વરસે થતી અઝાદારીએ ઇમામ ક્રમે ક્રમે બંધ કરાવી. હવે માત્ર મુંબઇના જમાતખાનામાં બાકી રહી છે જેને પણ ચાલુ સાલે બંધ કરવાને સ્વાર્થીઓએ ભારે જુસ્મેશ ચલાવી છે. મતલબ કે આ ભેળી કોમના ઉપર માલ મલીદા ઉડાવનારો વર્ગ ફાવી ગયો છે. ખોજા ઇસમાઇલી તથા ઇસનાઅશરી કોમમાંના અઝાદારીના હામીઓએ અઝદારી અટકાવવા સામે ભારે પ્રોટેસ્ટ કરવો જોઇતો હતો. જે તેમણે કર્યો નહિ અને ગુમરાહ કોમને રાહ પર લાવનારૂં જે એક ઉમદા સાધન હતું તે ખોઇ નાખ્યું. જેનો હવે અફસોસ કરવો નકામો છે.

ઇસમાઇલી સાહિત્ય ઉત્તેજક મંડળ તરફથી મી૦ ઉનાવાળાએ " મુશ્કેલાત ભાગ ૧ લો " પોતાની ઇસમાઇલી કોમમાંથી અઝદારી દુર કરવાને છપાવેલ નથી, કેમકે ત્યાં તો હવે અઝા

realpatidar.com

https://archive.org/details/bk068/page/n6/mode/1up

realpatidar.com

દારીનું નામો નીશાન પણ રહેવા દીધું નથી, પણ માત્ર ઇસના અશરીઓની છેડખાની કરવા તથા તેમનામાં થતી અઝાદારી અટકાવવાને છપાવેલ છે. જે તેના લખાણથી પુરવાર થાય છે. આ ઇસમાઇલી સાહિત્ય ઉંજક મંડળવાળા કેટલા અધા જાહેલ છે તે એટલા ઉપરથીજ પુરવાર થાય છે કે અઝાદારીએ ઇ. માઅને તેમણે રોવું કુટવું સમજી લીધું. હઝરત ઇમામ હુસેન અ૦ ના કરબલાના ગમખાર હેવાલમાં સત્ય પ્રત્યે ફીદાગીરી, અસત્ય પ્રત્યેનો તિરસ્કાર, ધર્મ તથા દેશના ઉદ્ધાર માટેની કુરબાનીઓ, ઇસલામનું સંરક્ષણ, ઇસલામી દેશોની ઉન્નતિ, જુલમ સામે પ્રોટેસ્ટ, સત્યાગ્રહ, નૈતિક હિમ્મત વીગેરે વીગેરે સેંકડો બાબતોના સુંદર પાઠો છલાછલ ભરેલા છે તે આ આંખના આંધળાઓ તથા ગાંઠના પુરાઓને નજરેજ ચડયા નહીં. ખુદાતાલાએ જેમના કલેજાં પર મોહોર કરી આપી હોય તેને સુઝે પણ ક્યાંથી ? !

ઇસમાઇલી સાહીત્ય ઉ૦ મંડળ આવું અક્કલનું ખાં હોવા છતાં તેણે ઇસનાઅશરીઓની અઝાદારી સામે હુમલો કીધો. જે અઝાદારીના પ્રતાપે હજારો ખોજા કુટુંબો મોટી કપટ જાળથી છુટયા છે તેની તેઓને કેમ કદર ન હોય. મતલબ કે મી૦ ઉનાવાળાનો પ્રહાર જોઇ જુદા જુદા ઇસનાઅશરી લેખકોએ મી૦ ઉનાવાળાના ચીથરે હાલ પેમ્ફલેટની હાજરી લેવા માંડી. મી૦ મુસા ભાઇ જાફર મુમણે " હકીકતે મુશકેલાત " રચી મી૦ ઉનાવા

realpatidar.com

https://archive.org/details/bk068/page/n7/mode/1up

realpatidar.com

ળાએ જે ઉટપટાંગ આધારો પકડયા હતા તેનું ખંડન કરી બતાવ્યું. આ દફએ મુશકેલાતની એટલી કદર થઇ કે તેની ત્રણ ત્રણ આવૃતી છપાઇ વકફ થઇ કોમમાં ફેલાઇ.

વળી મી૦ હુસેન મેગજી ટીંગાલીવાળાએ "અઝાદારી યાને મી૦ ઉનાવાળાને દંદાંશીકન જવાબ" નામે પેમ્ફલેટ મી૦ ઉનાવાળાના મુશકેલાતના ખંડનમાં લખી છપાવ્યું કે જેણે મી૦ ઉનાવાળાની પોકળ દલીલોને ઘાસફુસની જેમ ઉડાવી દીધી. આ પેમ્ફલેટ પણ ઘણી પસંદગીને પાત્ર્યું અને તેની બે આવૃતીઓ છપાઇ વકફ થઇ કોમમાં ફેલાઇ.

મી૦ ઉનાવાળાએ એવી મહાન પવિત્ર વસ્તુ ઉપર પ્રહારો કરેલા છે કે, જે વ.પે. જુદા જુદા સંખ્યાબંધ રદીઆ બહાર નહિ પડે ત્યાં સુધી ઇસનાઅશરી લેખકોને સંતોષ થશે નહિ. મી૦ મુસાભાઇ જાફર તથા મી૦ હુસેનભાઇ મેઘજી પછી મી૦ મોહમેડનનો આ પ્રયાસ મી૦ ઉનાવાળાના રદમાં અને અઝાદારીની હિમાયતમાં છે કે, જે અમારા તરફથી પ્રગટ થતા માસીક "નુરે હીદાયત" ના પુસ્તક પાંચના અંક ૫-૬ માં છપાયો છે. ઉક્ત લેખ જુદાહેદા પેમ્ફલેટથી છપાવવાને મી૦ મોહમડને, ઇસનાઅશરી અખબારોના અધીપતીઓ તથા લેખકો પાસેથી અભીપ્રાય માગેલો હતો. જે અભીપ્રાય સાથે અમોએ સંમત થઇ, તેને જુદાહેદા પેમ્ફલેટથી પ્રગટ કરવાને તેના ખર્ચ માટે કોમ પાસે અપીલ ગુજારી હતી. ઇસ્નીવાળા ઇસનાઅશરી અખબારોના

realpatidar.com

https://archive.org/details/bk068/page/n8/mode/1up

realpatidar.com

અધિપતીઓએ પણ અમારા મત સાથે સંમત થઇ મી૦ મોહમેડનના અભીપ્રાયને ટેકો આપેલો.

આ અપીલ હજરત ઇમામ હુસેન અ૦ ની અઝાદારીની હીમાયત માટેની હતી, તેથી તે જરૂર વ્યવહારૂ રીતે અમલમાં મુકાશે એવી અમોને ખાત્રી હતી. હાલમાં અનલહાવા (માકા-ગારકાર) વાળા મોહીબ્બે હુસેન શેઠ વલીભાઇ શરીફે પોતાના મરહુમ ભાઇ નાસર શરીફની રૂહના સવાબ માટે આ પેમ્ફલેટની એક હજાર નકલો છપાવી ઇસનાઅશરીઓ અને ખાસ કરીને ઇસમાઇલીઓમાં વહેંચ ફેલાવવાનો ઓરડર આપેલો, જેથી સદરહુ પેમ્ફલેટની એક હજાર નકલો છપાવી છે તે અઝાદારાંને હુસેન અ૦ તેનો કામમાં ફેલાવો કરવાના અમારા પ્રયાસમાં ટેકો આપશે એવી આશા રાખવામાં આવે છે.

શેઠ વલીભાઇ શરીફના આ શુભ પ્રયાસને કોમ માનભરી દ્રષ્ટિથી જોશે. એટલુંજ નહિ પણ બીજા ઓમંતો પણ તેમનું અનુકરણ કરી આવા ઉપયોગી સાહિત્યના પ્રચારમાં ટેકો આપશે. ખુદાવાલા પેમ્ફલેટ લખનાર મી૦ મોહમેડન તથા છપાવી વહેંચ કરાવનાર શેઠ વલીભાઇ શરીફને તુલ ઉમ્ર અતા ફરમાવે અને આવા તેહીના સેંકડો કામો કરવાની તક આપે, તેવી અંતઃકરણ પુર્વકની દુઆ સાથે આ ટુંક પ્રસ્તાવના સમાપ્ત કરીએ છીએ.

એદલજી ધનજી કાપા.

અઝાદારે હુસેન.

realpatidar.com

https://archive.org/details/bk068/page/n9/mode/1up

realpatidar.com

realpatidar.com

https://archive.org/details/bk068/page/n10/mode/1up

realpatidar.com

સોબુતે અઝાદારી.

હ૦ ઇમામે હુસેન અ૦ ના ગમમાં રોવા તથા માતમ કરવા વીશેની ખુબીઓ ઇતીહાસમાંથી મી૦ ઉનાવાળાને જવાબ તરીકે મી૦ અએન તથા મી૦ મુસાભાઇ જારર તથા મી૦ હુસેન મેઘજી તથા મી. ગુલામહુસેનભાઇ તરફથી સતાવાર દલીલોથી સાબેત કરી આપેલ છે, જેને વાસ્તે મજકુર સાહેબોને ધન્યવાદ આપ્યા વગર રહી શકાતું નથી, બાદ આએ લેખમા અમોએ નામદાર આગાખાન સર સુલતાન મહમદશાહ જી. સી. આઇ. ની મુખ જુબાનીથી તથા તેમના માતુશ્રી બીબી સમસુઉલમુલ્ક તે બીજા આગાખાંન અલીશા હની મહેરહારની મુખ જુબાનીથી તથા મી. ઇનરરારીટી, તે નામદાર આગાખાન સર સુલતાન મહમદશાહના બેરીસ્ટરનાં ભાષણથી સાબીત કરી આપ્યું છે. ઇમામે હુસેન અ૦ ના ગમમાં રોવું તેમાં વાંધો નથી. વાસ્તે ઇનસાફી વાચક વર્ગ પાસે અમારી નમ્ર અરજ છે કે, આગાખાન તો મજલીસે હુસેન અ૦ પડવામાં અને રોવામાં ને ગમ કરવામાં કાંઇ વાંધો નહી જણાવે. જ્યારે મી૦ ઉનાવાળા અને એઓના જેવા બીજાઓ આડકતરી રીતે મજલીસે હુસેન અ૦ કરતાં અટકાવે તો, તેવા મજલીસે હુસેન અ૦ ના વીરોધીઓની વાત પર કાંઇ ધ્યાન નહીં આપતાં હમેશાંથી

realpatidar.com

https://archive.org/details/bk068/page/n11/mode/1up

realpatidar.com

ઔજાઓમાં થતી મજલીસે હુસેન અ૦ કાયમ રાખશે એવી અ મારી ખરા અંતઃકરણ પુર્વકની લાગણી છે.

સને ૧૯૦૫ માં મુકદમો નં. ૭૨૯ જે મુંબઇ મધ્યે મી૦ રસલ સન્મુખ ચાલેલો, જેમાં વાદી હાજી બીબી તે આગા મુસુલ શાહની વીધવા વીરૂદ્ધ પ્રતીવાદીઓ નામદાર આગાખાન સર સુલતાન મહમદશાહ જી. સી. આઇ તથા બીજા તેર જણાઓ.

વાદીના તરફથી મી૦ બહાદુરજી તથા મી૦ સેતલવાડ.

પ્રતીવાદી નામદાર આગાખાન તરફથી મી૦ ઇંકવેરારીટી, મી૦ રેકસ, મી૦ લાઉન્ડસ હાજર થયા હતા.

મજકુર કેસનો ફુંક જજમેંટનો સાર સરસ્વતી પ્રીન્ટીંગ પ્રેસ પાયધુની મુંબઇમાં સને ૧૯૦૮ સંવત ૧૯૬૪ માં છપાએલ, તે બુકમાંથી આએ સવાલ જવાબ રજુ કરૂં છું.

(મંગળવાર તા. ૨૩ જુન સને ૧૯૦૮)

મી૦ ઇનવેરારીટી સવાલ પુછે છે ને લેડી અલીશાહ જવાબ આપે છે.

સ૦—હસનઅલીશાહના વખતમાં મોહરમના દસ દીવસ તેઓ કયાં તશરીફ ફરમાવતા હતા ?

જ૦—તેઓ મોટા ખાનામાં જતા હતા અને દસ દીવસ ત્યાં જઇ રહેતા હતા.

realpatidar.com

https://archive.org/details/bk068/page/n12/mode/1up

realpatidar.com

સ૦—હસનઅલીશાહના વખતમાં રોજાખાની જમાતખાનામાં થતી હતી ?

જ૦—હા, નીચે ભોંય તળીએ થતી હતી.

સ૦—ત્યાં તમો હાજરી આપતા ?

જ૦—હા.

સ૦—રોઝાખાની કેટલો વખત ચાલતી હતી ?

જ૦—આશરે સાડાત્રણથી ચાર કલાક આખી પુરી કરતા લાગતા હતા.

સ૦—હસનઅલીશાહના વખતમાં રોજા પડતા, તે વખતે તેઓ ત્યાં કેટલો વખત થોભતા ?

જ૦—ઘણું ઘણું તો એક કલાક. એક કલાકથી વધુ વખત તેઓ રોકાતા નહીં.

સ૦—હસનઅલીશાહના મરણ પછી જમાતખાનામાં શરસી રોજાખાની થય છે ?

જ૦—નહીં, હસનાબાદના બંગલામાં હવે તે થાય છે.

સ૦—કોણના હુકમથી તેમ કરવામાં આવે છે ?

જ૦—આગા અલીશાહના. હસનાબાદમાં હાલ વખત સુધી તે કરવામાં આવે છે.

સ૦—અલીશાહના વખતમાં રોજાખાની વખતે તે હસનાબાદમાંજ જતા હતા ?

જ૦—હા.

realpatidar.com

https://archive.org/details/bk068/page/n13/mode/1up

realpatidar.com

સ૦—રોજાખાની પુરી થવાં શું કરવામાં આવે છે ?

જ૦—જમોરતનું ખાણું આપવામાં આવે છે અને તેની અ ઉજવણુ ખોજાઓ કરે છે.

સવાલ પુછનાર મી૦ બહાદુરજી, જવાબ આપનાર લેડી અલીશાહ.

સ૦—આ મુકદમામાં ધારાના હીમાયતીઓને તમો સલાહ આપો છે ?

જ૦—હા.

સ૦—ત્યારે આ મુકદમામાં સોલીસીટરોને સઘળી સલાહ તમોજ આપો ?

જ૦—જરૂરી સલાહ આપું છું.

સ૦—પણ સઘળી સલાહ તમો આપો છો કે નહીં ?

જ૦—મારા તરફથી હું સઘળી સલાહ આપું છું. મારા બેટા તરફથી તેઓ પોતેજ સલાહ આપે છે.

સ૦—તમારા એટરનીઓ એકજ છેની ?

જ૦—હા.

સ૦—આગાખાનના ઘરમાં કોઇ મરણ થાય છે તો ૪૦ દીવસ શોક પાળવામાં આવે છે ?

જ૦—નહીં.

realpatidar.com

https://archive.org/details/bk068/page/n14/mode/1up

realpatidar.com

સ૦—ત્યારે કેટલા દીવસ શોક પળાય છે ?

જ૦—સાત દીવસ સુધી.

સ૦—હસનઅલીશાહના મરણ બાદ ૪૦ દીવસ શોક પાળવામાં આવ્યો હતો કે ?

જ૦—શોક તો ૭ દીવસજ પાળવામાં આવ્યો હતો, પણ બનવા જોગ છે કે તેની વીધવાએ એક વરસ શોક પાળ્યો હોય.

સ૦—સાત દીવસ શોક કેવી રીતે પાળવામાં આવ્યો હતો ?

જ૦—પહેલા ત્રણ દીવસ ફાતેહાખાનીની ક્રીયા કરવામાં આવે છે અને સાતમે દીવસે કબરાનમાં જઈ કબર આગળ જાય છે.

સ૦—સય્યદ હુસેન યઝીદને તમે ઓળખો છો ?

જ૦—હા, તે એક રોજાખાન હતો.

સ૦—તે એક અસનાઅશરી હતો ?

જ૦—હા.

સ૦—હસનઅલીશાહ જ્યારે મરણ પામ્યા ત્યારે સય્યદ હુસેનની ઝઈદીએ તેમની લાશને નહવાડીને મુકી હતી કે

જ૦—મેં તેમ સાંભળ્યું નથી. તે રોજાખાનીની ક્રીયા કરવાને આવ્યો હતો. બીજા ઘણા હાજર હતા.

realpatidar.com

https://archive.org/details/bk068/page/n15/mode/1up

realpatidar.com

મી૦ હુનવેરારીટી સવાલ પુછનાર ને જવાબ આપનાર લેડી અલીશાહ.

સ૦—કરાચીથી તમો આવ્યા ત્યારે હસનઅલીશાહની લાશ ક્યાં હતી ?

જ૦—જમાતખાનામાં રાત્રે મરણ પામ્યા હતા. જમાતે આગા અલીશાહને કરાંચી ખાતે તાર મોકલાવ્યો હતો, જે મારી હાજરીમાં વાંચવામાં આવ્યો હતો. તેમા લખેલું હતું કે "શાહ હસનઅલીશાહ મરણ પામ્યા છે, તેના જનાજાનું શું કરવું ?"

સ૦—તમારા ખાવીંદે શું હુકમ કર્યો ? ”

જ૦—તેણે એક તાર કરી લાશને જમાતખાનામાં તરત લઈ જવા હુકમ કર્યો.

સવાલ પુછનાર મી૦ હુનવેરારીટી, જવાબ આપનાર આગાખાનનો ચુસ્ત મુરીદ જુમા જાનમોહમદ

સ૦—ઇમામ હુસેન અ૦ પર જે આફતો પડી, તેને લગતું ભણતર ક્યાં થતું હતું ?

જ૦—ઇમામ હુસેનનો કીસ્સો જમાતખાનાની ઉપર કચ્છી ભાષામાં વાંચવામાં આવતો હતો.

સ૦—કીસ્સએ હુસેન જમાતખાનાના ઉપરના મકાન શીવાય બીજે કોઇ ઠેકાણે પડવામાં આવે છે ?

realpatidar.com

https://archive.org/details/bk068/page/n16/mode/1up

realpatidar.com

જ૦—ખોજાઓને ઘેર. જે એ કીસ્સો પડી જાય છે તે ખોજાઓ જઇ પડે છે ને તે બાદ થાલ સુફરામાંથી થયેલી પૈસાની ઉપજ જમાતખાનામાં જમે થાય છે.

હસનઅલીશાહના મુરીદ: અલાદીન ગુલામહુસેનની જુબાની.

સ૦—ઇમામ હુસેનનો કીસ્સો તમે જમાતખાનામાં ક્યારથી સાંભળ્યો હતો ?

જ૦—સમજણો થયો ત્યારથી હું પોતે પણ એ કીસ્સો સવંત ૧૯૩૦ ની સાલથી મીમ્બર પર બેસી વાચું છું.

સવાલ પુછનાર મી. ઇનવેરારીટી, જવાબ આપનાર નામદાર આગાખાન સર સુલતાન મહમદશાહ જી. સી. આઇ.

સ૦—રોજાખાનીમાં ઇમામ હુસેનના સંકટોનું વર્ણન છે ?

જ૦—હા.

સ૦—તે જમાતખાનામાં ઇમામ હુસેનના કીસ્સાને નામે પઢવામાં આવે છે ?

જ૦—હા.

સ૦—બધા શીઆઓમાં તેમજ સુનીઓમાં ઇમામ હુસેનનો કીસ્સો અથવા રોઝાખાની વાંચવામાં આવે છે ?

realpatidar.com

https://archive.org/details/bk068/page/n17/mode/1up

realpatidar.com

જ૦—હા. રાફીઓ તેને બયાન કહે છે.

સ૦—કોઇ વખત તમો રોઝાખાનીમાં ગયા છો ?

જ૦—કોઇ કોઇ વખત.

સ૦—ત્યાં તમે શું કરો છો ?

જ૦—હું નીચે બેસી જે મેવાનો આવે છે તે સાથે વાતો કરું છું. બે ત્રણ વખત રોઝાખાની પડતાં હોય ત્યારે હું પણ ગયો હોઇશ.

સ૦—રોઝાખાની પઢવામાં ઇસનાઅશરી કે ઇસમાઇલી એ આંખી કોઇને કાંઇ હરકત નથી ?

જ૦—હા, કેમકે એતો તવારીખ છે, અને અમુક દીવસે તેમની વર્ષ તીથી હોવાથી તે વાંચવામાં આવે છે.

નામદાર આગાખાનના બેરીસ્ટર મી૦ ધનવેશરાઈટીનાં ભાષણમાંથી નમુના દાખલ.

" ખોજાઓ રોજખાનીમાં જાય તેમાં કાંઇ વાંધો લેવા જેવું છેજ નહીં; પણ એ ફારસી ભાષામાં પઢાતી હોવાથી, અને ખોજાઓ તે ભાષા સમજતા નહીં હોવાથી, અને તેઓમાં ગુજરાતીમાં ઇમામ હુસેનનો કીસ્સો વંચાતો હોવાથી, કે જેનું બીજું નામજ રોજખાની છે. ફારસી રોઝાખાનીમાં ખોજાઓને જવામાં લાભ શું ? એ સબંધમાં જઘા સવાલો માત્ર વખત ગાળવા

realpatidar.com

https://archive.org/details/bk068/page/n18/mode/1up

realpatidar.com

માટેજ હતા. ચેંદી અલીશાહ પોતે પણ કહે છે કે હસનઅલીશાહ થોડો ભાગ લેતા હતા, પણ જવાહરત પહેલાં બીજાઓ છોડી જ તા હતા. રોજખાનીમાં ઇમામે ઇસમાઇલી બાબ તેમાં વાંચવા બહુ કાંઇપણ નથી, કેમકે એ માત્ર તવારીખની બીના છે, ઇમામ હુસેનને લગતી તવારીખ છે." વળી બીજી જગ્યાએ મી. ઇવનેરા રીટી કહે છે કે : રોજાખાની મહોરમના દીવસમાં પઢવામાં આવે, તે અને તેમાં હસન હુસેનને માથે પડેલી આફતના સબબમાં બનેલા બનાવો અને હરરોજ તેમણે શું શું કર્યું હતું, તેની યાદદાસ્ત તાજી કરવામાં આવે છે અને તેને રોજખાની કહે છે."

હવે ઉપર પ્રમાણે નામદાર આગાખાનના મુરીદોની જુબાનીથી તથા નામદાર આગાખાનની માતુશ્રીની તથા નામદાર આગાખાનની જુબાનીથી તથા મી. ઇવનેરારીટીના બાબતની સાફ જણાય છે કે, ઇમામે હુસેન અ. ની યાદમાં મજલીસો કરવામાં અને શોક પાળવામાં કાંઇ વાંધો નથી. જ્યારે ઇસમાઇલી સાહીત્ય ઉત્તેજક મંડળ તરફથી મુરમાજદ બાબુ ઉનાવાળાએ, મુસ્લેહાત હકીકત ભાગ ૨ લો છપાવી વીનંતી કરવા લીકેલ છે કે, "હઝરત નબી મોહંમદ મુસ્તફા સ. વ પવીત્ર ઇમામો અ. ના કુટુંબ વીરૂધ્ધ ચાલતા કેટલાક બંધુઓ અને તેઓને ચલાવનારા માનનીય "મુઅતકેદો" વ "આલેમો" મોહરમુલ મુબારેકમાં કરવામાં આવતા માતમ અને રડવાના અવાજો તથા કાળા કપડાં પહેરવાની રૂઢીઓ એ નીચે જણાવેલી હદીસોથી ખીલાફ છે!

realpatidar.com

https://archive.org/details/bk068/page/n19/mode/1up

realpatidar.com

કે નહી અગર બીલાફ છે તો અફ્કાત કહેરો, અને જો વાજબી હોય તો આપણા પાક નબી (સ૦) અને ઇમામો બરહકના ફરમાનોનું ઉલ્લંઘન થતું ન હોય, અને રડવા કુટવા તથા કાળા કપડા પહેરવાની રસ્મો કાયમ રહી શકતી હોય તો ખુલાસો બ હાર પાડીને મુશ્કીલ દુર કરશો." આવી રીતની બુક છપાવી દરપરદા ઇમામે હુસેન અ૦ ની અઝાદારી બંધ કરવાની વેતરણ કરી, પણ તેનો સતાવાર દલીલોથી મી૦ અયન તથા મી૦ મુલ્લા આન જાહેર મી૦ હુસેન મેઘજી તથા મી૦ ગુલામહુસેનભાઇ તર ફથી જવાબ અપાઇ ગયો છે, અને ઇતીહાસ વાંચનારાઓથી ખુબ જાણીતું છે કે હ૦ યાકુબ પયગમ્બર હ૦ યુસુફ પયગમ્બ રની જુદાઇમાં ઘણું રોયા છે તથા હ૦ ઝયનુલઆબેદીન અ૦ (કે જેને આરા આગાખાની ભાઇઓ પણ ઇમામ તરીકે માને છે તેઓ) હ૦ હુસેન અ૦ ના ગમમાં ઘણું રોયા છે, તથા હ૦ અલી અ૦ તથા હ૦ રસુલે ખુદા સ૦ ખુદાના આપેલા ઇ૦ લમથી જાણતા હતા કે, અમારા જીગરના ટુકડા હુસેન અ૦ પર આફત પડશે તેથી આપના શહીદ થવા અગાઉ આપની મુસીબ તપર રોયા છે, તથા આગળના ઓલુલ અઝમ પયગમ્બરો પણ ખુદાએ આપેલા ઇલમથી હ૦ હુસેન અ૦ સાથે આવનારા દુઃખ ઉપર અગાવથી રોયા છે તે ઇતીહાસ વાંચનારાઓથી અજાણ્યું નથી, બલ્કે યુરોપવાસીઓ ફીલોસોફરો તથા ડોકટરોએ ઇમામે હુસેન અ૦ ની શહાદત વીશે અને તેની યાદ તાજી રાખ્યાથી ઇસલામ વધુને વધુ ફેલાતો જવા વીશે સરસ મતો આપ્યા છે.

realpatidar.com

https://archive.org/details/bk068/page/n20/mode/1up

realpatidar.com

જે રીતેની જુદીજ બુક મી૦ આલીમોહમદ ગીગાભાઇ જોડીઆ બંદરવાળા તરફથી " ઇમામે હુસેન અ૦ ની શહાદત અને યુરોપીઅનોના મત " નામની બહાર પડેલ છે જે વાંચવા ભલામણ કરૂં છું.

હવે યુરોપીઅનો તો ઇમામે હુસેન અ૦ ની યાદને શરમ બતાવે, જ્યારે ઇસમાઇલી સાહીત્ય ઉતેજક મંડળ તરફથી પુર એ.ઇમ્દ માશુક હોનારાઓ હ૦ ઇમામ હુસેન અ૦ ના ગમમાં રોવા તથા માતમ કરવાની મનાઇ કરવા નીકળ્યા, તો તે ચીજ લેખોમાં માની લીધેલા ઇમામના વચનો શું કહે છે, તે તરફ વાંચક વર્ગનું ધ્યાન ખેંચુ છું. આ ઠેકાણે ખાસ નીચેની બાબતો ઇમતાહી વાંચક વર્ગ સામે રાખી ઇનસાફ ચાહું છું કે આ બુક મી૦ હિનાવાળાના નામથી ઇસમાઇલી સાહીત્ય ઉતેજક મંડળ તરફથી છપાય તો, તેવા મંડળને નીચેને આધારે ઇસમાઇલી સાહીત્ય ઉતેજક મંડળ કહી શકાય કે કેમ ? તે ચીજ હું ઇનસાફી વાંચકોના હાથમાં અભીપ્રાય સોપું છું.

૧ ના૦ આગાખાન હસનઅલીશાહ મોટા જમાતખાનામાં જાતે જઇ મોહરમના દસ દીવસ રોઝાખાની (મજલીસે હુસેન અ૦) મા ભાગ લેતા હતા.

૨ ના૦ અલીશાહ પણ રોઝાખાની (ફારસી ભાષામાં મજલીસે હુસેન અ૦) જમાતખાનામાં નહી કરતાં, હસનાબાદના

realpatidar.com

https://archive.org/details/bk068/page/n21/mode/1up

realpatidar.com

ખોજાઓમાં કરતા હતા, જ્યારે સીંધી ભાષામાં જે કીસ્સો છે તે જમાતખાનાઓમાંજ પડાતો હતો.

૩ રોઝાખાની પુરી થયા બાદ ખાણું આપવાનું આવતું હતું, ને તેની ગોઠવણ ખોજાઓ કરતા હતા.

૪ ખાસ હસનઅલીશાહના ગુજરવા બાદ સાત દીવસ શોક પાળવામાં આવ્યો હતો. જેમાં પહેલા ત્રણ દીવસ કુરાનેહખાની કરી. વળી સઇયદ હુસેન વઝદી જે કે ઇસનાઅશરી રોઝાખાન હતો, તે ખાસ રોઝાખાનીની ક્રીયા કરવા આવેલ હતો.

૫ આગાખાનના ખાસ મુરીદોની જબાનથી સાબીત થયું છે કે, ખોજાઓને ઘેર પણ ઇમામે હુસેન અ૦ નો કીસ્સો કચ્છી ભાષામાં પડવામાં આવે છે.

૬ ખાસ હાલના ના૦ આગાખાને પણ કોર્ટમાં કબુલ કર્યું છે કે, રોઝાખાનીમાં ઇમામે હુસેન અ૦ ના સંકટોનું વર્ણન છે, તે જમાતખાનામાં ઇમામે હુસેન અ૦ ના કીસ્સાના નામે પઢવામાં આવે છે. બધા શીઆઓમાં તેમજ સુન્નીઓમાં ઇમામ હુ-સેન અ૦ નો કીસ્સો અથવા રોઝાખાની વાંચવામાં આવે છે. ઇસમાઇલી કે ઇસનાઅશરીને રોઝાખાની પઢવામાં હરકત નથી.

૭ ના૦ આગાખાનો પોતે પણ તથા દરેક આગાખાનો અર્જ લોકો હુસેન અ૦ ના જખ્મને પોતાના મુરીદો પર હાબસો બેસાડે, જાણકે કોર્ટમાં સાર કહે કે ઇસમાઇલીઓને કાંઇ વાંધો નથી, જો

realpatidar.com

https://archive.org/details/bk068/page/n22/mode/1up

realpatidar.com

ઉપરથી મી૦ ધનવેરારીટી જેઓ આગાખાનના ધારાના હીમાય-તી પણ પોતાના ભાષણમાં જણાવે છે કે, ખોજાઓ રોજાખાનીમાં જાય તેમાં કાંઇ વાંધો લેવા જેવું છેજ નહી (વધુ ઉપર લેખમાં મી૦ ધનવેરારીટીનું ભાષણ વાંચો).

અહ ઠેકાણે એ વાત યાદ રાખવાની છે કે ના૦ આગાખાન તથા તેઓના માતુશ્રીના એટરનીઓ આજે કેસમાં એકજ હતા. વળી તેમની જુબાની પર મી૦ ધનવેરારીટીએ પુરતું વજન આપેલું છે, કે જે ખાસ આગાખાન તરફથી રોકવામાં આવેલા બેરીસ્ટર હતા.

મહેરબાન ધનસારી વાંચકો ! આગાખાનના વચનો તમો વાંચી ગયા, જ્યારે ઇસમાઇલી સાહીત્ય ઉતેજક મંડળ તરફથી મુરમામદ આબુલ ઉનાવાળા મુશાનીલાતની અંદર જણાવે છે કે " લેકીન યેહ બતા કે યઝીદકા દઔર કબ હુવા ? ઔર યેહ ગમ કબ હુવા ? ઔર છતની દેરમેં યહાં કયસે પહોંચા, જો બંધે થે ઉન્હોંને ઉસી જમાનેમેં ધસ જીવાનકારીકો મયરમ ખુબ દેખા. અવર જો બેહરે બજુજ થે, ઉન્હુંને યૈ હીકાયત સુની ;" વી. તો અમો અત્રે મી૦ ઉનાવાળાને તથા તેના મંડળને પુછશું કે, શું નામદાર આગાખાન પણ બહેરા છે કે ઇમામે હુસેન અ૦ ની રોજાખાનીઓમાં ઇમામે હુસેન અ૦ ના સંકટોનું વર્ણન છે, એમ કહે છે વાહ ઇસમાઇલી સાહીત્ય ઉત્તેજક મંડળ વાહ ! !

realpatidar.com

https://archive.org/details/bk068/page/n23/mode/1up

realpatidar.com

આરેખાર ઇન્તસાફનો હાથમાં રાખવો જોઇએ, અને અમારા આ લેખ વાંચ્યા બાદ કબુલ કરશે કે, મસનવી મઉલાના રૂમીના મજકુર શેઅર, જે અમોએ મજકુર બુકમાં છપાવેલ છે તે અમોને કબુલ નથી; અને આગા હસનઅલી તથા અલીશાહ તથા સુલતાન મહમદશાહ જી. સી. આઇ. જેમ મજલીસમાં જતા હતા તે તેઓ જણાવી ગયા છે કે મજલીસમાં જવામાં કાંઇ વાંધો નથી, તો અમો કબુલ રાખીએ છીએ કે હવેથી અમો જે કીસ્સો મોટા જમાતખાનામાં હમેશાં પડાતો હતો તે બાબત સાથી વળી બીજા ભાઇઓને ત્યાં પણ કીસ્સો મોહરમમાં વાંચતો હશે તોપણ વાંચો નહીં લઇએ.

હવે હું મુશ્કેલાતમાં પેઠો જે મૌલાના રૂમની મસનવી ઉપરથી ઉપજતા વિચારો મી૦ ઉનાવાળાએ બતાવ્યા છે તે પર આવું છું. આ લેખમાં ઉપર બતાવી ગયો છઉં કે આગાખાના હસનઅલીના મરણ પામવાથી જમાતે આગા હસનઅલીશાહને કરાંચી ખાતે તાર મોકલાવેલ, તેમાં લખેલું હતું કે " શાહ હસનઅલી મરણ પામ્યા છે તેના જનાજાનું શું કરવું ? " જવાબમાં અલીશાહે [illegible] લાશને જમાતખાનામાં લઇ જવા તાર કર્યો. વળી ત્રણ દિવસ હાજરીખાની [illegible], વળી સઇયદ હુસેન વગેરે રોજાખાની કરવા આવેલ હતો, વળી હસનઅલીશાહ તથા [illegible]શાહ દરેક કામ સ્વતંત્રપણે કરતા હતા. તે પણ મજકુર કોર્ટમાં જુબાની પડેલ છે. તેમજ હસનઅલીશાહના કુટુંબ.

realpatidar.com

realpatidar.com

આ કોઇ ગુજરી જાય તો સાત દીવસ સુધી શોક પાળે રાખો આ વે છે તે પણ કોરટમાં સાબીત થએલ. જ્યારે આગે ઉનાવાળાને કેવા વીચારો ઉપજે છે તે જુવો.

મરવું કહે છે કોને ? તુટે રૂહના જ્યાં બંધ સમજી કરો પસંદ
છુટે જો કોઇ કેદથી રોવે કે ખુશી થાય ? એ સાર જો સમજાય
પીંજરેથી મુર્ખ પંખી ફરી પેસવાને ચહાય ? એવી છે હાય હાય
ઇસલામનો ઉદ્દેશ ન સમજ્યા અરે અફસોસ રાખો તો જરા હોશ
ફરમાન ખુદા રસુલનાં કરવાં ન ફરામોશ છે સબ્રમાં સંતોષ
કુટો પીટો છો કોને ? નથી રૂહ તો મરતું. જો રાખ ખમરતું
ગુરે ઇમામ કાબીલે માતમ નથી ડરતું. રહે જીસ્મ બદલતું.

હવે આ ઉપરથી એમ બતાવે છે કે મરવું કહે છે કોને ? જ્યારે નામદાર આગાખાન શું કહે છે તે વાંચો.

સવાલ પુછનાર મી૦ ઇનવેરારીટી, જવાબ આપનાર
આગાખાન મહમદ સુલતાન.

સ૦—૧૯ મી રાત પવિત્ર કેમ છે ?

જ૦—હજરત અલીને તે રાત્રે ઘા લાગ્યો હતો.

સ૦—૨૧ મી રાત્રે ?

જ૦—તે મરણ પામ્યા.

realpatidar.com

https://archive.org/details/bk068/page/n25/mode/1up

realpatidar.com

સ૦—બીબી સાહેબને હસનઅલીશાહના મરણ બાદ જે કાંઈ મળે છે તે કેવી રીતે મળે છે ?

જ૦—મારી રાજીખુશીથી મને મળેલી નજરોમાંથી આપવામાં આવે છે.

સ૦—તમારા પેનશન ચાલુ રાખવા બાબતમાં તમારા પર લખવામાં આવેલા પત્રની આ નકલ છે ?

જ૦—હા, અલીશાહના મરણ બાદ મને કેટલા મહીના બાદ પેનશન મળ્યું ન હતું, પણ તે બાદ નામદાર હીંદી સરકાર તરફથી મુંબઈની સરકારે રૂ. ૧૦૦૦ નું પેનશન મારે માટે ચાલુ કર્યું હતું, અને તેને લગતો આ પત્ર છે.

નામદાર આગાખાનના લેખીત બચાવ પૈકી કેટલાક ફકરા.

હું કબુલ કરૂં છઉં કે નામદાર પહેલા આગાખાનના મરણ પછી તેવણની મીલકતો મુસલમાન કાયદા મુજબ તેવણની વીધવા, તેવણના ત્રણ છોકરાઓ અને તેવણની ત્રણ છોકરીઓએ તે મેળવી હતી.

હવે મારા સુજ્ઞ વાંચકો ખુદાના વાસ્તે ઈનસાફની નજરે ક હેશો કે મી૦ ઉનાવાળા કહે છે કે " જો અધે થે ઉન્હુને ઉસી જમાનેમેં પસ ઝીયાન કારીકા બચશ્મે ખુદ દેખા. અવર જો બહરે મજરૂજ થે, ઉન્હુને યે હીકાયત સુની " વીગેરે વીગેરે. તો

realpatidar.com

https://archive.org/details/bk068/page/n26/mode/1up

realpatidar.com

આગાખાનથી શું ઉનાવાળા વધુ સમજે છે ? કે, આગાખાનના મજકુર વાકયો ઉપર ભરોસો નથી રાખતા ? આ તરફ આગાખાન તો કોરટમાં જુબાની આપે કે, રમઝાનની ૨૧ મી રાત્રે હ૦ અલી મ૦ મરણ પામ્યા છે. જયારે બીજી તરફ ઉનાવાળા એવું બતાવવાની વેતરણ કરે છે કે ફકત નુરે ઇમામત જીસ્મ બદલતુ રહે છે હવે જો હ૦ અલી મ૦ મરણ પામ્યા, એમ જો બહેરા માણસોએ સાંભળ્યુ હોયતો, આગાખાનના ઉપલા વાકયોનું શું સમજવું ? વળી જો ઇમામતનુ નુર કાબીલે માતમ નથી હોતું તો શું કામ તમારા માની લીધેલા ઇમામ હસનઅલશાહનો શોક સાત દીવસ રાખવામાં આવ્યો ? વળી આ શેઅરમાં તો ખુબ ભેજુ વાપર્યું છે. " મરવું કહે છે કોને ? નુરે હકના જ્યાં બદન-સમજી કરો પસંદ " વાહ બીરાદર વાહ ! કુલ શેઅરો વાંચતા એવો સાર નીકળે છે કે, મોત કહે છે કોને ? નુરે ઇમામત જામો બદલ્યા કરે છે પણ ભાઇજી તમારે બરાબર યાદ રાખવુ જોઇએ કે, તમારા માની લીધેલા ઇમામ તો દરેક ઠેકાણે મરવું હક છે એવી જુબાની કોરટમાં આપી આવ્યા છે ને અમો આ શું કહીએ છીએ ? વળી જમાત તો હસનઅલીશાહના મરણનો તાર કરી આગા અલીશાહને પુછાવે ! અત્રે એ સાફ માલુમ પડે છે કે, જો અલીશાહની અંદર નુરે ઇમામતનો જામો હતે તો, જરૂર હસનઅલીશાહનો ગુજરી જવાનો તાર મળતાં પહેલાં પોતાને ખબર પડી જાત, પણ નુરે ઇમામતના જામા જેવું કાંઇ હતું નહીં, અગર આ જમાત વીશે મી૦ ઉનાવાળા

realpatidar.com

https://archive.org/details/bk068/page/n27/mode/1up

realpatidar.com

શું કહે છે, વળી કોરટમાં પડેલી જુબાનીઓથી હસનઅલીશાહના મરણ બાદ ફાતેહાખાની ત્રણ દીવસ કરી ને સાતમે દીવસે ખંદા નમાં અથા કબર આગળ જાય છે તે પણ સાબીત થએલ છે, હવે જો મરણ ન માનવામાં આવે તો ફાતેહાખાની એટલે શું ને શોક એટલે શું ? આવી રીતે હસનઅલીશાહના કુટુંબમાં શોક પાળવામાં આવતો રીવાજ કે જ્યાં કુલ મુખ્તેયાર દરેક જમાનાના આગાખાન જેમકે હસનઅલીના જમાનામાં હસનઅલીની સતા, તેઓના મરણ બાદ નાં૦ અલીશાહની સતા, તેઓના મરણ બાદ નાં૦ આગાખાન અહમદશાહની સતા, તેમ વળી જમાત તાર કરી લાશ વીશે પુછાવે. વીગેરે બાબતોથી તો સાફ સુરજના પ્રકાશની માફક રોશન છે કે, દરેક જીવ દુન્યા ઉપર આવે છે તેને મરીને અલ્લાહને જવાબ દેવો છે. જુવો કુરઆનમાં પણ સાફ છે કે (કુલ્લો નફસિન ઝાએકતુલ મૌત) " તમામ નફસ મોતની મજા ચાખશે " વળી બીજે ઠેકાણે છે (કુલ્લો મન અલયહા ફાન વયબકા વજહો રબ્બેક ઝુલજલાલે વલ ઇકરામ) આ આયતોમાં તરજુમા તમોએ કબુલ કરેલી પ્રોફેસરની તફસીર ખોલી વાંચશો તો માલુમ પડશે. વાસ્તે હવે પછી મહેરબાન ઉતાવળા ઇનસાફને હાથમાં રાખી, પોતાની થએલી ભુલો વીશે ખુદા પાસે માફી ચાહી, ઇસલામી આલમને બતાવી આપે કે, અમે આગાખાનના આ વચનોને પાળવા ખાતર મુશકેલાતની બહાર કરેલા એઅતેરાઝને પાછા ખેંચી લઇએ છીએ. બાઇજી હજી વખત છે, ખુદાને કયામ

realpatidar.com

https://archive.org/details/bk068/page/n28/mode/1up

realpatidar.com

તામાં જવાબ દેવો છે. કબરમાં સુતું છે. વાસ્તે વીચારો, ને આ પણા ભોળા ભાઇઓને ભમાવવાનું મુકી આપો. હ૦ હુસેન અ૦ ની મજલીસની બરકતથી દીન દુન્યાનો થતો ફાયદો સુર્યના તે જની માફક રોશન છે, આવા ફાયદાથી ગરીબ ભાઇઓને મહેરૂમ ન રાખો. અરે, જે હુસેન અ૦ ની શહાદત વીશે યુરોપીઅનો. ફીલોસોફરો અને ડોકટરો સરસ અભીપ્રાય જણાવે, જ્યારે એક મુસલમાન હોવાનો દાવો કરનાર મજલીસે હુસેન અ૦ દર પરદા બંધ કરવા કોશીશ કરે તે પણ જમાનાની બલીહારી છે. હવે હું આએ લેખ સમાપ્ત કરવા પહેલાં મારા કુંન બોજા ભાઇઓને વીનંતી કરું છું કે, આપણામાં જે હમેશાંથી મજલીસે હુસેન અ૦ કે જેનું બીજું નામ કીસ્સો વંચાય છે, તે હમેશાંના ધારા મુજબ કાયમ રાખશે.

આહમેદન.

realpatidar.com

https://archive.org/details/bk068/page/n29/mode/1up

realpatidar.com

તંબીહુલ ખ્વારીજ.

યારો હુસેન શીદ્દયે દાવર હે યા નહિ ?
એહલે જીહાંકા સઇયદો સરવર હે યાં નહિ ?
રૂતબેમે સબ શહીદુંસે બરતર હે યા નહિ ?
કુચ્છભી નહિ વે.. સીબ્તે પયગમ્બર હે યા નહિ?

ક્યા વોહ તુમ્હારે ઝેમમે આઅસુમભી નથા ?
સઇયદભી એ ગુનાહભી મઝલુમ ભી નથા ? ૧

યારો હો તુમભી ઉમ્મતે પૈરૂલ અનામમે
જાનેકી આરઝુ ભી હે દારૂસ સલામ મેં
શીરકત અગર ગુનાહ હે ઇસ નેક કામમેં
હારેજ નહો હમારે અઝાએ ઇમામમેં

રસ્મે અઝાએ સીબ્તે નબી જો મીટાઓગે
મેહશરમે કયા રસુલકો તુમ મુંહ દીખાઓગે ? ૨

યારો કરો ન બુખ્લ ઝરાસે કે વાસ્તે
આંસુ નહિ બહોતહી રૂપાસેકે વાસ્તે
રોએ હેં ખુદ રસુલ નવાસે કે વાસ્તે
આએ થે જીબ્રઇલ દીલાસે કે વાસ્તે

realpatidar.com

https://archive.org/details/bk068/page/n30/mode/1up

realpatidar.com

કયું કર નહો ગમ ઉસકા જીપા કાએનાતમેં
જીસપર રસુલ રોએ હેં એહદે હયાતમેં ૩

મારો વહાબીયું કે ન બરેમેં આઓ તુમ
હેરતકી દસ્ત ખુદ સે ખુદકો બચાઓ તુમ
મીરઝાઇયુંકી બાત ન ખાતીરમેં લાઓ તુમ
મેહરે હુસેન શોકસે આંસુ બહાઓ તુમ
જહેદે હુસેન તુમકો વહાં બક્ષવાએગા,
દુન્યાને મોઆવીયા ન કીયામતકો આએગા ૪

મારો કુચ્છ અપને હાલકી તુમકો નહિ ખબર
મેહફીલમેં હાલ કાલકી દેખા હે બેશતર
રોતે હો તુમ તડપતે હો તુમ પીટતે હો સર
આરાત ભી થરકતી હેં તબ્લેકી થાપ પર
બસ શીર્ક જવાઝમેં ફતવાએ આમ હો
ઝીકરે હુસેન વાઝ મેં લેકીન હરામ હો ૫

મારો તુમ્હારે પાસ ભી ઇસકા હે કુચ્છ જવાબ
મુંગેર હશ્રમેં જો રસુલે ફલક જનાબ
ક્યા મેરે બાદ તુમમેં ખુદાકી ન થી કીતાબ ?
આમિનાકે કતલકા તુમ્હેં માલુમ થા અઝાબ ?
તુમ શીર ભી ઝાલમું કે તરફદાર હો ગએ
મઝલુમસે ગરીબસે બેઝાર હો ગએ ૬

realpatidar.com

https://archive.org/details/bk068/page/n31/mode/1up

realpatidar.com

દાખીલ યઝીદીઉંમેં હો તુમ લોગ સબકે સબ
જાઓ મોઆવીઆસે શફાઅત કરો તલબ
મુશતાક સબુંકા હે દોઝખમેં જુ લહબ
દાવત કરેગી ધુમસે હમ્મા લતલ હતબ

ઝક્કુમ ખાઓ ચખો અઝાબે શદીદ ભી
ફીન્નાર તુમ ઓર તુમ્હારા યઝીદ ભી ૭

સુન સુનકે યેહ કલામ રીસાલત મઆબકે
હોંગે હવાસ બાખ્તા હર શેખો શાબ કે,
રેહ જાએંગે ઝબાનકે દાંતુંમેં દાબ કે,
લીપટેંગે તુમ સબુંકો ફીરસ્તે અઝાબકે

લે જાએગી સકરમેં મહબ્બત યઝીદકી
રેહમતસે દૂર હોગે ખુદાએ મજીદકી, ૮

યારો હુસૈન બાગે રીસાલતકા ફુલ હય
લખ્તે જીગર નબીકા હય ઇબ્ને બતુલ હય
દેખો વોહ ખમસતુન નોજબામેં શામુલ હય
જો દુશ્મને અહલે બેત ખબાહત કે ગુલ હય

અયસા ન પા સકોગે સેતુદા સયર ઇમામ
ખુદ ઇમામ બાપ ઇમામ ઓર પીસર ઇમામ ૯

realpatidar.com

https://archive.org/details/bk068/page/n32/mode/1up

realpatidar.com

યેહ હાલ સબ કીતાબું મેં લીખ્ખા હે દેખલો
ઇરશાદ ક્યા રસુલને ખુદાકા હે દેખ લો
અજરે રીસાલત ઇસકે સીવા ક્યા હે દેખ લો
કુરઆંનમેં અવદતે કુર્બા હે દેખ લો

કુરઆન તુંમને હીફઝ કીયા ફીર ભુલા દીયા
બુગ્ઝે યઝીદ નેહસને અંધા બના દીયા ૧૦

અફસોસ તુમ હુસેનકો પેહચાનતે નહિ
ક્યા મરતબે હુસેન કે હેં જાનતે નહિ
તુમ જાનતે હો ખુબ મગર માનતે નહિ
ક્યું તુમ કીતાબ જેહલસે ગરદાનતે નહિ

મુરશેદ બને હેં જોકે ખુદ એહલે ફસાદ હેં
આલીમ જીન્હેં સમઝતે હો વોહ બેસરાર હેં ૧૧

તુંમ જાહેલુંકો સમઝે હો આલીમ ગઝબ યેહ હે
ગુમરાહ તુમકો કરતે હેં ઝાલીમ ગઝબ યેહ હે
ઇમાન ઇનકે ખુદ નહિ સાલીમ ગઝબ યેહ હે
તુમસે છુપા રહે હેં મઆલીમ ગઝબ યેહ હેં

આલીમ ઉન્હેં ન સમઝો ઝોલુમો જોહુલકે
મુઝસે સુનો યેહ દુશમને આલે રસુલ હેં ૧૨

realpatidar.com

https://archive.org/details/bk068/page/n33/mode/1up

realpatidar.com

યેહ તુમકો રાહે રાસ્ત ન હરગીઝ દીખાંએંગે
જન્નતસે ફેર કર તુમ્હેં દોઝખમેં લાએંગે
ખુદ હેં શરીર કબ તુમ્હેં શરસે બચાએંગે
ખુદ ખારજી હેં યેહ તુમ્હેં ખારજ બનાએંગે

બદબખ્ત ખુદ હેં કેહરે ખુદામેં ઘીરે હુએ
કલમેસે મુનહરીફ હેં નબીસે ફીરે હુએ ૧૩

આલીમ કહાંસે હોગે યેહ ખુદ બે સવાદ હેં
કયા ઉનસે ખેરહો જો મુજસ્સીમ ફસાદ હેં
દુશમન નબીકી આલકે યેહ બદનેહાદ હેં,
મકરો દગામેં સાનીએ ઇબને ઝીયાદ હેં

વીકતેહેં નામસે યેહ હુસેને શહીદ કે
ચેલે મોઆવીઆકે કે હેં ગુરગે યઝીદ કે ૧૪

આલીમ જો બા અમલ હેં મીલો ઉન્સે જાકે તુમ
ઔસાફ ઉન્સે પુછો શહે કરબલાકે તુમ
યેહભી નહિ તો ઝેહમતે આલી ઉઠાકે તુમ
મઝહબકી અપને દેખો કીતાબેં મંગાકે તુમ

કારી હો ખુદ તમીઝે મખારેજકી ચાહીએ
સુની ન કોઇ બાત ખોવારીજકી ચાહીએ ૧૫

realpatidar.com

https://archive.org/details/bk068/page/n34/mode/1up

realpatidar.com

યારો મેં જાનતા હું કે અંજાન તુમ નહિ
લીખ્ખે પઢે હો એસેભી નાદાનભી નહિ
યેહ બાતભી ગલત હે કે ઇનસાન તુમ નહિ
કયા અઝમેં યેહ કહું કે મુસલમાન તુમ નહિ

બાહરે હુસેન કુફ્ફ્રતેકે ગબરો યહુદ ભી
ઇસ ગમસે હોતે હેં મોતાસીર હોનુદ ભી ૧૬

રોના હુસેનપર નહિ આતા તુમ્હી યેહ કયા ?
આખે તો હેં નઝર નહી આતા તુમ્હીં યેહ કયા?
રહેમ એક ગરીબપર નહી આતા તુમ્હીં યેહ કયા
ઇનસાફ કુછભી કર નહિ આતા તુમ્હીં યેહ કયા

મીલતે હો ઝાહેરા બઝુરૂરત હુસેન સે
દીલમેં ભરી હુઇ હે કાદુરત હુસેનસે ૧૭

બુઝકે હુસેન લાએગા તુમપર તબાહીયાં
ઇસ બુગઝમેં તબાહ હુઇ બાદશાહીયાં
પૈદા હુઇ તુમ્હારે લીયે રૂ સીયાહીયાં
યેહ તો સહી કે કસ્બ કરે બિન બીયાહીયાં

ગરાઝ સકર મકર ન કહીં પરભી પાએગે
નાશાદ ના મુરાદ ઝમાનેસે જાઓગે ૧૮

realpatidar.com

https://archive.org/details/bk068/page/n35/mode/1up

realpatidar.com

રોતે નહિ હો તુમ શાહે આલમકે વાસ્તે
તાકીદ હે હદીસુંમેં ઇસ ગમકે વાસ્તે
લાઝીમ હે શર્મ કુછ બની આદમકે વાસ્તે
રખ્ખા ખુશીકો તુમને મોહર્રમકે વાસ્તે

આશે નજાતો મફરહે જુર્મે શફીદ હો
ઐારાતમેં તુમ્હારી જપા જશને ઇદ હો ૧૯

ઇસ આહમેં છુપ હે શહાદત હુસૈન કી
લુટી ગઇ તમામ મુઝાબત હુસેન કી
તુમ યાદ કયા કરોગે મુસીબત હુસેનકી
દીલમેં ભરી છુપ હે અદાવત હુસેનકી

મોમીનકા દીલતો આતેશે ગમસે કબાબ હો
લેકીન તુમ્હારે બઝમમેં દોરે શરાબ હો ૨૦

realpatidar.com

realpatidar.com

મફત મળતી કીતાબો.

વરતેજીને ત્રેપન સવાલો—મી. જીમે મી. વરતેજીને ત્રેપન સવાલો પુછી ઇસમાઇલી ધર્મનું પોઝીશન સાફ કરવાને પુછેલાનું પેમ્ફલેટ

મી૦ હુદાને ત્રીશ સવાલો—મી. બએને મી. હુદાને ત્રીશ સવાલો હાજર ઇમામની ઇમામતની દલીલો બતાવવાને પુછેલાનું પેમ્ફલેટ

મી૦ હુદાને પ્રતિઉતરો—મી. હુદાએ રચેલી ઇમામે મોજુદ નામની ચોપડીનું હેરત પમાડનારી દલીલોથી ખંડનનું પુસ્તક.

ખોજા મઝહબનાં કેટલાક મુળતત્વો—ના. આગાખાને પોતાના મુરીદો માટે છપાવેલી કીતાબની મી. કાબાએ બાજુ બાજુતી છપાવી છે વીરમગામવાળા શેઠ મામદભાઇ હાજી પનજી તથા રેમતલાભાઇ સીદીએ વક્ફ કરાવી છે.

હક્કે મુશ્કેલાત—મી. ઉનાવાળાએ હજરત ઇમામ હુસેન અ૦ ની અઝાદારીની વીરૂધ્ધમાં છપાવેલા પેમ્ફલેટનું ખંડન મી૦ મુસાભાઇ જાફરે લખેલું.

અઝાદારી યાને મી૦ ઉનાવાળાને દંદાશીકન જવાબ—મી૦ ઉનાવાળાના રદીઆમાં આ દંદાશીકન કીતાબ મી૦ હુસેન મેબજીએ લખી છે

સોબુતે અઝાદારી—મી૦ મોહમેદને સધ્ધર દલીલોથી અઝાદારીને આગાખાન તથા આગાખાનીઓની જુબાની પરથી સાબીત કરી ઉનાવાળાને જવાબ આપ્યો છે.

દરેક કીતાબનું પોસ્ટેજ પેહોંચ ખર્ચ એક એક આનો.

લખો-નુરે હીદાયત ઓફીસ—અમરેલી—કાઠીઆવાડ

realpatidar.com

https://archive.org/details/bk068/page/n37/mode/1up

realpatidar.com

નુરે હીદાયત.

"નુરે હીદાયત" નામનું માસિક છપાવ્યું આજ પાંચ વર્ષ થયા ઘણી આબો તાબ સાથે દર અંગ્રેજી મહિનાની પહેલી તારીખે બહાર પડે છે જેમાં ઇસલામની ખરી ખુબીઓ બતાવી બેદીનોની સખ્ત ઝાટકણી કાઢવામાં આવે છે ઉપરાંત સાંસારીક કેળવણી બાબેના ઉમદા લેખો આપી કોમને આગળ વધવા ઉશકેરવામાં આવે છે. ખોજાઓ તથા મોમીન કોમની દીની તથા દુન્યવી સુધારણા માટે ખાસ ધ્યાન આપવામાં આવે છે રોયલ આઠ પેજી પાંચ ફારમનું છતાં લવાજમ માત્ર રૂ. ૨ પોસ્ટેજ સાથે ગ્રાહક પાસેથી રૂ. ૫) પહેલા, બીજા, ત્રીજા તથા ચોથા વર્ષની બાઇન્ડીંગની ફાઇલોના દરેકના રૂ. પાંચ પાંચ પોસ્ટેજ ચાર ચાર આના.

એદલજી ધનજી કાભા

અધિપતિ "નુરે હીદાયત"

અમરેલી–કાઠીયાવાડ

realpatidar.com